



બાળકો/વિદ્યાર્થીઓ માટે કોવિડ-19 સ્ક્રિનિંગ

કૃપા કરીને બાળ સંભાળ/JK-12 સ્કૂલ સેટિંગમાં પ્રવેશતાં પહેલાં પૂર્ણ કરો.

અપડેટ કર્યું સપ્ટેમ્બર 1, 2021

1. શું બાળક/વિદ્યાર્થીને નિમ્નલિખિત નવા અથવા વધુ ખરાબ થતાં લક્ષણો છે?*



તાવ > 37.8°સે
અને / અથવા ઠંડી



ઉધરસ



ઘાસ લેવામાં મુશ્કેલી



સ્વાદ અથવા ગંધમાં ઘટાડો
અથવા નુકશાન



ઉબકા, ઉલટી અથવા ઝાડા

• જો બાળક / વિદ્યાર્થીને આરોગ્ય સંભાળ પ્રદાતા દ્વારા નિદાન કરવામાં આવેલી આરોગ્ય સ્થિતિ હોય કે જેનાથી તેમને લક્ષણ આવે છે, તો "ના" પસંદ કરો. જો લક્ષણ નવું, અલગ અથવા વધુ ખરાબ થઈ રહ્યા હોય તો "હા" પસંદ કરો.

જો કોઈ લક્ષણ
માટે "હા" હોય:



ઘરે રહો અને સ્વ-
અલગ રહો



પરીક્ષણ
કરાવો

અથવા



આરોગ્ય સંભાળ
પ્રદાતાનો સંપર્ક કરો

2. તમારા ઘરમાં કોઈને કોવિડ-19 ના એક અથવા વધુ લક્ષણો છે અને/અથવા લક્ષણો આવ્યા પછી પરીક્ષણ પરિણામોની રાહ જોઈ રહ્યા છે?

હા
ના

• જો બાળક/વિદ્યાર્થીએ સંપૂર્ણપણે રસી* પ્રાપ્ત કરી લીધેલ છે અથવા છેલ્લા 90 દિવસોમાં કોવિડ-19 નું હકારાત્મક પરીક્ષણ થયેલ હોય અને સાફ થઈ ગયેલ હોય, તો "ના" પસંદ કરો.

3. છેલ્લા 10 દિવસો, શું બાળક/વિદ્યાર્થીનું રેપિડ એન્ટિજેન ટેસ્ટ અથવા ઘર-આધારિત સ્વ-પરીક્ષણ કીટમાં હકારાત્મક પરીક્ષણ થયેલ છે?

હા
ના

• જો તેઓનું ત્યારથી પ્રયોગશાળા આધારિત PCR કસોટીમાં નકારાત્મક પરીક્ષણ થયું હોય, તો, "ના" પસંદ કરો.

4. શું વિદ્યાર્થી / બાળકને કોવિડ -19 ધરાવતા કોઈના નજીકના સંપર્ક તરીકે સૂચિત કરવામાં આવ્યું છે અથવા ઘરે અને સ્વ-અલગતામાં રહેવા માટે કહેવામાં આવ્યું છે?

હા
ના

• જો બાળક/વિદ્યાર્થીએ સંપૂર્ણપણે રસી* પ્રાપ્ત કરી લીધેલ છે અથવા છેલ્લા 90 દિવસોમાં કોવિડ-19 નું હકારાત્મક પરીક્ષણ થયેલ હોય અને સાફ થઈ ગયેલ હોય અથવા જાહેર આરોગ્યએ કહ્યું છે કે બાળક/વિદ્યાર્થીને સ્વ-અલગતામાં રહેવાની જરૂર નથી, તો "ના" પસંદ કરો.

5. શું છેલ્લા 14 દિવસોમાં, બાળક/વિદ્યાર્થીએ કેનેડાની બહાર પ્રવાસ કર્યો હતો અને ફેડરલ સંસર્ગનિષેધ જરૂરીયાતો અનુસાર સંસર્ગનિષેધમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી?

હા
ના

જો 2, 3, 4 અથવા 5
પ્રશ્નોમાં "હા" હોય:



ઘરે રહો અને સ્વ-
અલગ રહો



જાહેર આરોગ્ય સલાહને
અનુસરો



* સંપૂર્ણપણે રસીકૃત એટલે બે ડોઝ રસી શ્રેણીનો બીજો ડોઝ અથવા એક ડોઝ શ્રેણીનો એક ડોઝ મેળવ્યાના 14 દિવસ પછી.

**કોઈપણ જે બીમાર છે અથવા બીમારીના કોઈ લક્ષણો ધરાવે છે તેણે ઘરે રહેવું જોઈએ અને જો જરૂરી હોય તો તેમના આરોગ્ય સંભાળ પ્રદાતા પાસે આકારણી કરાવવી જોઈએ.